

તત્કાલ/એન.એ./એસ.આર/૮૦૮૬ થી ૮૧૦૪/૨૦૧૬-૧૭
નં. જમીન/ડી/કલમ-૬૫/વશી/૪૮/૧૬
બિનખેતી શાખા, કલેક્ટર કચેરી,
રૂમ નં. ૩૦, કોઠી બિલ્ડીંગ,
વડોદરા તા. ૨૪/૧૦/૨૦૧૬

વંચાણમાં લીધા

- (૧) અરજદારશ્રી ભરવાડ ભવાનભાઈ રૂખડભાઈ વિગેરે રહે. બાપોદ ગામ, વાઘોડીયા રોડ, તા. જી. વડોદરાની "તત્કાલ બિનખેતી યોજના" હેઠળ બિનખેતીની પરવાનગી મેળવવાની તા. ૦૨/૦૭/૧૬ ની અરજી તથા રજુ થયેલ આધાર પુરાવા
- (૨) અત્રેના જ. સુ. શાખાના હુકમ નં. ટેનન્સી/એ/એસઆર/૨૮૩-૧૨/૧૬ તા. ૧૨/૦૫/૧૬
- (૩) સહાયક નગર નિયોજકશ્રી, વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ, વડોદરાના પત્ર નં. યુડીએ/પ્લાન-૨/અ/૧૦૫૫/૧૬ તા. ૧૪/૦૭/૨૦૧૬
- (૪) નાયબ કલેક્ટરશ્રી, જમીન સુધારણા, વડોદરાના પત્ર નં. ટેનન્સી/એ/વશી/૬૩૪૦/૧૬ તા. ૧૩/૦૭/૧૬ થી રજુ થયેલ અભિપ્રાય
- (૫) સક્ષમ અધિકારી અને નાયબ કલેક્ટરશ્રી (જ. સુ.) વડોદરાના પત્ર નં. યુ. એલ. સી./વશી/૧૪૧૨/૧૬ તા. ૨૨/૦૮/૧૬ થી આવેલ અભિપ્રાય
- (૬) નગર રચના અધિકારીશ્રી, નગર રચના યોજના એકમ-૪, વડોદરાના પત્ર નંબર નરયો/નં. ૪૪ (બાપોદ)/વડોદરા/કેસ નં. ૧૬૨/૪૬૩ તા. ૧૮/૦૭/૧૬
- (૭) મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૮ ની કલમ-૬૫ તથા મુંબઈ જમીન મહેસૂલ નિયમો ૧૯૭૨ ના નિયમ-૧૦૦, ૧૦૧
- (૮) ગુજરાત સરકારશ્રી મહેસૂલ વિભાગના છેવટના ઠરાવ ક્રમાંક: બખપ/૧૦૦૬/૪૨૫/ક, તા. ૦૧/૦૭/૨૦૦૮ તા. ૨૦/૦૮/૧૬ ની કાર્યાલય નોંધ ઉપર અચાયેલ આદેશ



અરજદારશ્રી ભરવાડ ભવાનભાઈ રૂખડભાઈ વિગેરે રહે. બાપોદ ગામ, વાઘોડીયા રોડ, તા. જી. વડોદરાની વંચાણ-૧ ની અરજીથી "તત્કાલ બિનખેતી યોજના હેઠળ તેઓની માલીકીની એપેન્ડીક્સ-એ માં દર્શાવેલ જમીનની બિનખેતીના હેતુ માટે ઉપયોગ કરવા પરવાનગી મળવા માંગણી કરેલ છે.

એપેન્ડીક્સ-એ માં જણાવેલ જમીનમાં કબજેદારોએ સોગંદનામામાં જણાવેલ છે કે, સવાલવાળી જમીન સ્થળે ખુલ્લી છે. બાંધકામ નથી અને તેમના પ્રત્યક્ષ કબજા ભોગવટાની આવેલ છે તથા સવાલવાળી જમીનમાં બાંધકામ કરેલ નથી તે અંગેના ચતુર્દિશાના ફોટોગ્રાફ્સ રજુ કરેલ છે. સવાલવાળી જમીનમાં અરજદારનું નામ કબજેદારમાં ચાલે છે તથા શહેરી જમીન ટોચ મર્યાદા અને નિયંત્રણ અધિનિયમ ૧૯૭૬ કાયદા અન્વયે પ્રશ્નવાળી જમીન ફાજલ થયેલ નથી કે સરકાર પક્ષે કબજો લેવાયેલ નથી તેમજ અન્ય કોઈ કોર્ટ કાર્યવાહી ચાલુમાં ન હોવાનું જમીન સંપાદનની કાર્યવાહી ચાલતી ન હોવાનું સોગંદનામું રજુ કરેલ છે. અરજદારએ તત્કાલ બિનખેતી યોજના અંગેનું નિયત બાંહેધરી ખત તથા સોગંદનામું રજુ કરેલ છે.

વંચાણ-૨ ના હુકમથી સવાલવાળી પ્રતિબંધિત શરતની જમીનને પ્રિમીયમની રકમ વસુલ લઈ જમીન જુની શરતમાં શરતફેર કરવા પરવાનગી આપવામાં આવેલ છે.

વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ, વડોદરાએ વંચાણ-૩ થી જી.ડી.સી.આરના ઝોનીંગ રેગ્યુલેશન મુજબ સવાલવાળી જમીનને અરજદારશ્રીની માંગણી મુજબના હેતુ માટે બિનખેતીની પરવાનગી આપવામાં આવે તો ઝોનની દૃષ્ટિએ વાંધા સરખું નથી, તેમ અભિપ્રાય આપેલ છે.

નાયબ કલેક્ટરશ્રી જમીન સુધારણા વડોદરાએ સવાલવાળી જમીનમાં શરતકેર પરવાનગી આપવાના કામે મેળવેલ અભિપ્રાયોની નકલ વંચાણ-૪ ના પત્રથી રજુ કરેલ છે.

સક્ષમ અધિકારી અને નાયબ કલેક્ટરશ્રી (જ.સુ.) શ.જ.ટો.મ.ની કચેરી વડોદરાના વંચાણ-૫ થી મોજે બાપોદ તા.જી.વડોદરાના સ.નં.૧૦૨૬ ટી.પી.નં.૪૪, ફા.પ્લોટ નં.૧૬૪/૨ ની ૫૫૯ ચો.મી. વાળી જમીનને બિનખેતી રહેણાંકના હેતુ માટે શરતકેર કરવા પરવાનગી અપાય તો હરકત સરખું જણાતું નથી. તેમ અભિપ્રાય આપેલ છે.

નગર રચના અધિકારીશ્રી એકમ-૪, વડોદરાના વંચાણ-૬ ના પત્રથી આપેલ અભિપ્રાય મુજબ મોજે બાપોદના રે.સ.નં.૧૦૨૬, મુળખંડ નં.૧૬૪, મુળખંડનું ક્ષે.૬૦૭૦, અંતિમખંડ નં.૧૬૪/૧, ૧૬૪/૨, અંતિમખંડનું ક્ષેત્રફળ ૩૦૮૩ તથા ૫૫૯ મળી કુલ ૩૬૪૨ ચો.મી. ફાળવેલ છે.

એપેન્ડીક્સ-એ (જમીનની વિગત)

- કબજેદારશ્રી : (૧) શ્રી ભરવાડ ભવાનભાઈ રૂખડભાઈ
(૨) શ્રી ભરવાડ જીલયબેન રૂખડભાઈ
(૩) શ્રી ભરવાડ જાલાભાઈ રૂખડભાઈ
(૪) શ્રી ભરવાડ લીલાબેન રૂખડભાઈ
(૫) શ્રી ભરવાડ જીવણભાઈ કાનજીભાઈ
(૬) શ્રી ભરવાડ ભરતભાઈ કાનજીભાઈ

મોજે બાપોદ

સ.નં.૧૦૨૬

બિનખેતી હેતુ :-

ટી.પી.નં.૪૪

રહેણાંક

તા.વડોદરા

ફા.પ્લોટ નં.૧૬૪/૨

જીલ્લો :- વડોદરા

૫૫૯ ચો.મી.

એપેન્ડીક્સ-બી (કરવેરાની વિગત) રહેણાંક હેતુ માટે

- | | |
|----------------------|-------------|
| (૧) રૂપાંતર કરની રકમ | રૂ. ૫,૫૮૦/- |
| (૨) વિશેષધારો | રૂ. ૧૪૦/- |
| (૩) લોકલ ફંડ | રૂ. ૭૦/- |
| (૪) શિક્ષણ ઉપકર | રૂ. ૩૫/- |

રૂપાંતરકરની રકમ રૂ.૫,૫૮૦/- (અંકે રૂપિયા પાંચ હજાર પાંચસો નેવું પુરા) તા.૨૮/૦૮/૧૬ તથા માપણી ફી રૂ.૧૦,૫૦૦/- (અંકે રૂપિયા દસ હજાર પાંચસો પુરા) તા.૨૮/૦૮/૧૬ ના રોજ ભર્યાનું ચલન રજુ કરેલ છે. વિશેષધારો, લોકલ ફંડ અને શિક્ષણ ઉપકરની રકમ નીચે મુજબ તલાટીશ્રી બાપોદની કચેરીમાં જમા કરાવી અસલ પહોંચ અત્રે રજુ કરેલ છે.

વિશેષધારો, લોકલ ફંડ અને શિક્ષણ ઉપકરની રકમ નીચે મુજબ તલાટીશ્રી બાપોદની કચેરીમાં જમા કરાવી અસલ પહોંચ અત્રે રજુ કરેલ છે.

- | | | | | |
|------------------------|-----------|------------|----|-------------|
| (૧) વિશેષધારો/લોકલ ફંડ | રૂ. ૬૩૦/- | પહોંચ નંબર | ૫૮ | તા.૨૭/૦૮/૧૬ |
| (૨) શિક્ષણ ઉપકર | રૂ. ૧૫૬/- | પહોંચ નંબર | ૧૬ | તા.૨૭/૦૮/૧૬ |



સબબ ઉપરોક્ત હકીકતે જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ ની કલમ-૬૫ અન્વયે એપેન્ડીક્સ-એ માં દર્શાવેલ સવાલવાળી જમીનનો એપેન્ડીક્સ-એ માં દર્શાવેલ હેતુ માટે બિનખેતીનો ઉપયોગ કરવા નીચે દર્શાવેલ શરતોએ પરવાનગી આપવા હુકમ કરવામાં આવે છે.

શરતો :-

- (૧) આ પરવાનગી સ્થાનિક સત્તા મંડળ દ્વારા રજુ કરવામાં આવતાં નકશા તેમજ વિકાસ પરવાનગી શરતોના અમલીકરણને આધિન રહેશે. વધુમાં વિકાસ પરવાનગી અન્વયે કરવામાં આવતો વિકાસ અને તેનો વપરાશ વિકાસ યોજનાના નિયંત્રણો વિનિયમો તેમજ "વુડા"/મ્યુનિ.કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વખતો વખતના આદેશો/ નિર્દેશનોનો આધીન રહેશે. જમીનના માલિક/ કબજેદારોએ પરવાનગી હેઠળની જમીનનો વિકાસ સંબંધિત સત્તા મંડળની વિકાસ પરવાનગી આધીન રહીને જ કરવાનો રહેશે.
- (૨) વરસાદી પાણીના ભૂગર્ભ વહન/સંચય માટે દર મકાન/ બહુમાળી મકાન દીઠ એકના દરે વરસાદી પાણીના નિકાલ માટે " પરકોલેટીંગ બોર " ની વ્યવસ્થા અચૂક કરવાની રહેશે.
- (૩) એપેન્ડીક્સ-એ માં દર્શાવેલ બિનખેતી હેતુ તેમજ ક્ષેત્રફળ મુજબ એપેન્ડીક્સ-બી મુજબ કરવેરા ભરવાના રહેશે સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી સિવાયના અન્ય હેતુ માટે ઉપયોગમાં લઈ શકશે નહીં.
- (૪) નિયમોનુસાર સદર પરવાનગી હેઠળની જમીનનો ઠરાવેલ વિશેષધારાએ અત્રેથી ફેરફાર કરવામાં ન આવે ત્યાં સુધી દર વર્ષે પહેલી ઓગષ્ટ થી નિયત થયેલ મહેસુલી વર્ષથી ભરવાનો રહેશે ઉપરાંત કબજેદારો તે પરથી નક્કી થતો લોકલ ફંડ, શિક્ષણ ઉપકર તથા અન્ય કરવેરા પણ દર વર્ષે ચુકવવાના રહેશે. વિશેષધારો વડોદરા શહેરી વિસ્તાર પુરતો સુપ્રિમ કોર્ટમાં આ બાબતનો નિકાલ આવ્યેથી તે ચુકાદાને આધીન રહીને ભરવાનો રહેશે. પરંતુ બિનખેતીનો ઉપયોગ શરૂ કરવામાં ન આવે ત્યાં સુધી ઉક્ત ઠરાવેલ વિશેષધારો દર વર્ષે બમણાં દરે ભરવાનો રહેશે.
- (૫) સદરહું પરવાનગીની તારીખથી દિન-૩૦ માં ડિસ્ટ્રીક્ટ લેન્ડ રેકૉર્ડ મારફતે માપણી કરવાની રહેશે. જે માપણી મુજબ સાઈટ પ્લાનની નકલો અત્રે રજુ કરવાની રહેશે. તથા ક્ષેત્રફળની વધઘટ મુજબનો વિશેષધારો તેમજ અન્ય ઉપકરો કબજેદારે ભરવાનો રહેશે.
- (૬) જમીનની તબદીલી ફેરફાર તથા જમીન અંગેનાં અન્ય તમામ આનુસંગિક કાયદાઓને આધીન રહીને આ પરવાનગી આપવામાં આવેલ છે. જેથી અન્ય કોઈ કાયદા હેઠળ મેળવવાની થતી જરૂરી પરવાનગીઓ મેળવી લેવાની રહેશે.
- (૭) સવાલવાળી જમીનમાંથી ઇલેક્ટ્રીક લાઈન, વીજળી ગ્રીડના તાર/ હાઈટેન્શન પાવર / થાંભલા કે ટેલીફોન લાઈન પસાર થતી હશે તો આવી લાઈન કે તેના થાંભલા ભવિષ્યમાં નાંખવાના થશે તો તે અંગે વળતર મેળવવા હકક દાવો થઈ શકશે નહીં.
- (૮) સદરહું પરવાનગી તારીખથી ૬ (છ) માસમાં બાંધકામ શરૂ કરી ત્રણ વર્ષમાં પુરૂ કરવાનું રહેશે.
- (૯) બાંધકામનો ઉપયોગ શરૂ કરતાં પહેલાં બી.યુ. અર્થાત બિલ્ડીંગ વપરાશની પરમીશન મેળવી લેવાની રહેશે.



(૧૦) આ હુકમમાં અગર સનદમાં કોઈ કારકુનની અથવા ગણતરીની ભુલો હશે તો તેમાં સુધારો થઈ શકશે/ સુધારાપાત્ર રહેશે તથા આ સુધારો અરજદારને બંધનકર્તા રહેશે.

(૧૧) આ પરવાનગી તારીખ પછી નમુના " એમ " માં સનદ તૈયાર થયેથી અરજદારે નિયત નમુનામાં સનદ ભરાવી લેવાની રહેશે.

(૧૨) કબજેદારે બાંધકામ શરૂ કર્યા બાદ એક માસની અંદર જીલ્લા કલેક્ટરશ્રીને તે મતબલની લેખિતમાં જાણ કરવાની રહેશે. તેવી જ રીતે જે બાંધકામ છે. તે પુર્ણ થયેથી પણ એક માસની અંદર તેની લેખિત જાણ જીલ્લા કલેક્ટરશ્રીને કરવાની રહેશે.

(૧૩) આમુખ નં.(૪) માં જણાવેલ ગુજરાત સરકારશ્રી મહેસૂલ વિભાગના છેવટના તા.૦૧/૦૭/૨૦૦૮ ના ઠરાવ ક્રમાંક: બખપ/૧૦૦૬/૪૨૫/ક, ના પરિશિષ્ટમાં ઉલ્લેખ (૧) થી (૧૮) તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અરજદારને બાહેધરી ખતની શરતોને આધીન આ મંજૂરી આપવામાં આવે છે. અરજદારે બાહેધરી ખતમાં ઉલ્લેખાયેલ તમામ શરતોનું પાલન કરવાનું રહેશે. જો અરજદાર ઉક્ત ૧ થી ૧૨ શરતો તેમજ બાહેધરી ખત પૈકીની કોઈ પણ શરતોનો ભંગ કરશે તો તેની સામે શરતભંગની કાર્યવાહી કરવામાં આવશે. ઉક્ત બાહેધરી ખતની નકલ સદર હુકમ સાથે સામેલ છે.

(૧૪) આ પરવાનગી અરજદારે રજૂ કરેલ વિગતોનાં આધારે આપવામાં આવેલ છે. રજૂ થયેલ કોઈ વિગત ખોટી હોવાનું જાહેર થયેથી કે ઉપરની નિર્દોષ કોઈ પણ શરતોનો ભંગ થયેથી આ પરવાનગી આપોઆપ રદ થયેલી ગણાશે તથા જમીન મહેસૂલ કાયદા ૧૮૭૯ અંતર્ગત કલમ ૭૯(એ) હેઠળ પગલાં લેવાની પાત્ર રહેશે. અને તત્કાલીન અમલમાં હોઈ તેવા બીજા કોઈપણ કાયદાની જોગવાઈઓનો બાધ વિના ઈન્ડિયન પીનલ કોડ હેઠળ કબજેદારો ફોજદારી ગુના માટે શિક્ષાત્મક પગલાં લેવાને પાત્ર બનશે તથા જમીન મહેસૂલ કાયદા ૧૮૭૯ ની કલમ ૬૬ તથા મુંબઈ જમીન મહેસૂલ નિયમો-૧૯૭૨ નાં નિયમોનાં નિયમ-૧૦૦ અનુસાર યોગ્ય તે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને બાંધકામ દુર કરાવવા સહીતનાં એક કે વધુ પગલાં લેવામાં આવશે.

(૧૫) સવાલવાળી જમીન અંગે અરજદારશ્રીએ રજૂ કરેલ સુચિત લે-આઉટ પ્લાનમાં દર્શાવ્યા પ્રમાણે રસ્તા પૈકીની જમીન, કોમન પ્લોટની જમીન અને સહીયારા ઉપયોગ માટે ખુલ્લી રાખેલ જમીનનું કોઈપણ રીતે વેચાણ થઈ શકશે નહીં.

બિડાણ :- બાહેધરી ખત

રવાના કર્યું

મામલતદાર (બિનખેતી)
કલેક્ટર કચેરી, વડોદરા.



સહી/-
(લોચન સેહરા)
કલેક્ટર વડોદરા

પ્રતિ,

(૧) શ્રી ભરવાડ ભવાનભાઈ રૂખડભાઈ

(૨) શ્રી ભરવાડ જીલયબેન રૂખડભાઈ

(૩) શ્રી ભરવાડ જાલાભાઈ રૂખડભાઈ

(૪) શ્રી ભરવાડ લીલાબેન રૂખડભાઈ

(૫) શ્રી ભરવાડ જીવણભાઈ કાનજીભાઈ

(૬) શ્રી ભરવાડ ભરતભાઈ કાનજીભાઈ

રહે.બાપોદ ગામ, વાઘોડીયા રોડ, તા.જી.વડોદરા.

નકલ રવાના :-

૧. મામલતદારશ્રી, વડોદરા શહેર (પુર્વ) તરફ હુકમની શરતોનો નોંધમાં ઉલ્લેખ કરી નોંધ પાડવા તથા નોંધ, ૭/૧૨ ની નકલ સહ જાણ કરવા સારું.

૨. મ્યુનિસિપલ કમિશનરશ્રી, વડોદરા મહાનગર સેવાસદન, ખંડેરાવ માર્કેટ, વડોદરા તરફ જાણ સારુ.
૩. જિલ્લા નિરીક્ષકશ્રી, જમીન દફતર / સીટી સર્વે સુપ્રીટેન્ડન્ટશ્રી નં. ૧, ૨, ૩, ૪ વડોદરા તરફ...
૪. તલાટી કમ મંત્રીશ્રી બાપોદ તા.વડોદરા તરફ હુકમ મુજબ અમલવારી કરવા સારુ
૫. જન સેવા કેન્દ્ર, કલેક્ટર કચેરી, વડોદરા તરફ જરુરી કાર્યવાહી કરવા સારુ.
(BAR CODE NO.64340)
૬. રેકર્ડ શાખા
૭. સિલેક્ટ ફાઈલ